


વાહકજન્ય રોગો

અટકાયતી અને નિયંત્રણ :

પગલાં અને આયોજન : સને ૨૦૧૫

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન



(હેઠ્ય મેલેરીયા વિભાગ)

**ACTION PLAN-2015**

-:: અનુકૂમણિકા ::-

અ.નૂ.	વિગત	પાના નંબર
૧	અનુકમણિકા	૧
૨	અમદાવાદ શહેર વિશે જાણકારી	૨
૩	પ્રસ્તાવનાં	૩-૪
૪	વાહકજન્ય રોગચાળાનાં પ્રકાર અને જવાબદાર કારણો	૫
૫	મેલેરીયા રોગોનાં પ્રકાર અને લક્ષણો, ડેન્યુ તાવનાં લક્ષણો	૬
૬	ચીકનગુનિયા તાવનાં લક્ષણો	૭
૭	અમદાવાદ શહેરમાં મેલેરીયાનુંપ્રમાણ	૮-૯
૮	મેલેરીયા સ્લાઈડ પોઝિટીવીટી રેટ, સ્લાઈડ ફાલ્સીપારમ રેટ	૧૦-૧૧
૯	આર.સી.એચ.નું યોગદાન, લીક વર્કરોની કામગીરી	૧૨ થી ૧૪
૧૦	સને ૨૦૧૫ નાં વર્ષ માટેનું આયોજન	૧૫ થી ૧૮
૧૧	તળાવોની વેળુટેશનમુક્ત જાળવણી	૧૯
૧૨	લોજસ્ટિક્સ, આરોગ્ય વિષયક લોક જાગૃતિ કેળવવા માટેની પ્રવૃત્તિઓ, વર્દ્ધકની સહાય	૨૦
૧૩	મચ્છર નિયંત્રણ-માસ વાઈઝ ઈન્ટર સેક્ટર એક્શન પ્લાન.	૨૧-૨૪
૧૪	મચ્છર ઉપદ્રવ / મચ્છરજન્ય રોગચાળાનાં નિયંત્રણ માટે મેલેરીયા વિભાગની કામગીરી	૨૫-૨૬
૧૫	મચ્છર ઉપદ્રવ / મચ્છરજન્ય રોગચાળાનાં નિયંત્રણ માટે અન્ય વિભાગની કામગીરી	૨૭-૨૮

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,

## આરોગ્ય-મેલેરીયા વિભાગ

### વાહકજન્ય રોગચાળો અટકાવવા માટેનો એક્શન પ્લાન



-: અમદાવાદ શહેર વિશે જાણકારી :-

અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. ૧૪૧૧ મા થઈ હતી. જેને ૬૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે. અમદાવાદ શહેર ભારત દેશમાં ૭ (સાતમા) નંબરે અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું સાબરમતી નદીનાં કિનારે આવેલું શહેર છે. બોખે રાજ્યનાં ભાગલાં પછી અમદાવાદ શહેર સને ૧૮૬૦ પછી ગુજરાત રાજ્યની રાજધાની હતી અને સને ૧૮૭૦ માં ગાંધીનગર ખાતે આ રાજધાની શીફ્ટ કરવામાં આવેલ. અમદાવાદ શહેરની વસ્તી સને ૧૮૮૧ માં ૨૮.૭૭ લાખ જેટલી હતી અને સને ૨૦૦૧ માં ૩૫.૦૦ લાખ તેમજ સને ૨૦૧૧ નાં સેન્સસ મુજબ આશરે ૫૬.૬૮ લાખ જેટલી વસ્તી નોંધાયેલ છે. જેનો વિસ્તાર સને ૧૮૮૧ મા ૧૮૦.૮૪ ચો.કિલોમીટરથી વધીને સને ૨૦૧૧ મા ૪૮૭ ચો.કિલોમીટર વ્યાપેલો છે. અમદાવાદ શહેરનું સુચારુ સંચાલન માટે વહીવટી વિકેન્ટ્રીકરણ કરી અમદાવાદ શહેર દ (૬) ઝોન ( ઉત્તર / દક્ષિણ / મધ્ય / પૂર્વ / પશ્ચિમ / નવા પશ્ચિમ ) માં વહેચાયેલ છે. દરેક ઝોનને ૮૦,૦૦૦ ની વસ્તી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કુલ ૬૪ વૉર્ડ કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કુલ ૬ (૬) ઝોન માટે આરોગ્ય વિભાગનાં મુખ્ય વડા તરીકે આરોગ્ય અધિકારીશ્રીને નિમવામાં આવેલ છે. કુલ ૬ (૬) ઝોન - મેલેરીયા વિભાગની કામગીરીનાં જરૂરી સુપરવિઝન / મોનીટરીંગ કરવા માટે આરોગ્ય અધિકારીશ્રીનાં તાબા ડેટની ૧ (એક) આસી.એન્ટોમોલોજીસ્ટશ્રી, ડિસ્ક્રીક્ટ વેક્ટર બોર્ડ ડિસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ અને પ્રતિ ઝોન દીઠ એક જુની. આસી. એન્ટોમોલોજીસ્ટ, મેલેરીયા સુપરવાઈઝર / મેલેરીયા ઈન્સ્પેક્ટર / મેલેરીયા ટેકનીકલ સુપરવાઈઝર તથા કુલ ૬૪ વૉર્ડ ૧ (એક) દીઠ મેલેરીયા સબ ઈન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. તમામ વૉર્ડ વિસ્તારમાં વર્કરો દ્વારા કરવામાં આવતી કામગીરીનું જરૂરી સુપરવિઝન / રિપોર્ટિંગ સંબંધિત વૉર્ડનાં મેલેરીયા સબ ઈન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે.

(૨) પ્રસ્તાવનાં :-

અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશન વિસ્તારની વસ્તી આશરે ૫૯.૬૮ લાખ તથા બહારથી આવતા માઈગ્રાન્ટ લોકોને ધ્યાનમાં લેતા અંદાજીત ૬૫ લાખ જેટલી કુલ વસ્તી થાય છે. જેમા અમદાવાદ શહેરમાં ૩,૦૦૦ જેટલી ચાલી અને રૂપડાઢી ( ચાલી વિસ્તારો ) આવેલા છે. ઉપરોક્ત વિસ્તારની વસ્તી અંદાજીત ૩૦ લાખની ઉપર છે. જેના માટે અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશનનાં આરોગ્ય વિભાગ દ્વારા ૬૧ વૉર્ડનાં શહેરી આરોગ્ય કેન્દ્ર મારફતે રસીકરણ, જનરલ ઓ.પી.ડી., એન્ટીનેટલ સારવાર, કિશોરીને માર્ગદર્શન, મમતા દિવસની ઉજવણી, જન્મ-મરણ, લગ્ન નોંધણી તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે પોલીયો, ટી.બી., એચ.આઈ.વી. એઈડસ, વિટામીન-એ સપ્લીમેન્ટરીસ તથા એપાટેમીક રોગોનું સર્વેક્ષણ જેમાં પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઇફોઇડ, કોલેરા, ઝડા ઉલ્ટી અને વાહકજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્યુ, ચીકનગુનિયા, જાપાનીસ એન્સેફ્લાયટીસ, કિમીઓન કોંગો વાયરસ, ચાંદીપુરા વાયરસ નિયંત્રણ જેવી વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. આમ અમદાવાદ શહેરમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો પ્રવર્તમાન હોઈ પુરતી તકેદારીનાં પગલાંડુપે અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશનનાં આરોગ્ય વિભાગ, સરકારી / ભૂનિસિપલ સંચાલિત હોસ્પિટલો, ઈજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, બગીચા ખાતુ, રેલ્વે, ગુજરાત એસ.ટી., એ.એમ.ટી.એસ., તમામ સરકારી / અર્ધ સરકારી, નામાંકિત રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય સંસ્થાઓનાં સહયોગ અને સુઆયોજન કરી અને શહેરમાં વસ્તાં નાગરીકો તરફથી પુરતા પ્રમાણમાં તકેદારી લેવામાં આવે તો ઉપરોક્ત રોગચાળાને કાબુમાં રાખી શકાય તેમ છે.

મેલેરીયા રોગ યેપી એનોઝીલીસ સ્ટીફનસાઈ અને ડેન્યુનું રોગ એડિસ ઇજાપી મચ્છરનાં કરડવાથી થાય છે. વાહકજન્ય રોગચાળો થવાનું મુખ્ય કારણ દર ૭ વર્ષનો સાયકલીક ટ્રેન્ડ તેમજ હેલ્પ વિભાગ દ્વારા વધારવામાં આવેલ સર્વેલન્સ સીસ્ટમમાં પ્રાઈવેટ હોસ્પિટલો, ક્લાનીકસનો સમાવેશ કરવાથી અને કલોરોકવીન ટેબલેટમાં રેઝસ્ટન્ટ નોંધાવાથી અને જાહેર જનતામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો / મચ્છરજન્ય રોગો નિયંત્રણ વિષયક જાગૃતિનાં અભાવનાં કારણે, ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદ અનિયમીત પડવાનાં કારણો પડકારડુપ છે. આ ઉપરાંત અ.ભ્ય.કો. નાં પેરોફેરલ વિસ્તારમાં ચાલતી સંખ્યાબધ્ય કન્સ્ટ્રુક્શન સાઈટો પણ છે કે જ્યા મહત્તમ પાણીનો સંગ્રહ કરી રાખવામાં આવતો હોવાથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. આ ઉપરાંત પંચમહાલ, ગોધરા, મધ્ય પ્રદેશ વિગેરે જેવા વિસ્તારોમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ મહત્તમ હોઈ શહેરમાં રોઝંડા મજૂરી માટે આવતો મજૂર વર્ગ ઉપર જણાવેલ વિસ્તારોમાંથી આવતાં હોઈ તેઓ મચ્છરજન્ય રોગો માટે વાહક તરીકેની ભુભિકા ભજવતાં હોઈ છે. જેમાં અમુક કિસ્સામાં આ પ્રમાણ વધારે જોવા મળેલ છે. જે ધ્યાનમાં રાખતાં ચોમાસાની સીઝન શરૂ થતા પહેલાં તમામ વિભાગો અને લોક જાગૃતિ અભિયાન દ્વારા, કન્સ્ટ્રુક્શન સાઈટો ખાતે ફિવર સ્કીનોગ દ્વારા સમયસર યોગ્ય પગલાં ભરવામાં આવે તો મચ્છર ઉત્પત્તિ / મચ્છરજન્ય રોગો ઉપર નિયંત્રણ મેળવી શકાય તેમ છે. સને ૧૯૯૧ થી ૨૦૧૪ દરમ્યાન નોંધાયેલ સાદા મેલેરીયા અને જેરી મેલેરીયાનાં કેસો દર્શાવિતો ગ્રાફ પેજ નં.૪ મુજબ છે. જે ધ્યાનમાં લેતા સ્પષ્ટ થાય છે કે મેલેરીયા રોગ સાઈકલીકલ ટ્રેન્ડ દરશાવી છે. જેથી દર ૭ થી ૮ વર્ષે મેલેરીયા રોગનાં કેસોમાં વધારો જોવા મળતો રહે છે.



• Data before 1991 is of Active Case Detection (Malaria Dept.) only, thereafter Passive Case Detection Agencies (Hospitals) cases were also included to know true prevalence.


• Since May 2007 including New West Zone data

### (૩) વાહકજન્ય રોગચાળાનાં પ્રકાર અને જવાબદાર કારણો :-

અમદાવાદ શહેર વિસ્તાર ઉષ્ણકટીબંધમાં આવેલ છે. અને સમગ્ર વર્ષ દરમ્યાન મોટા ભાગે શહેરનું હવામાન મંદ્રનાં જીવનચકને માફફ આવે તેવું છે. કારણ કે ઉનાળામાં મહત્તમ ૪૫ ડીચ્યી સુધી જ્યારે શીયાળામાં ન્યુનતમ ૧૩ ડીચ્યી તાપમાન નોંધાતું હોઈ છે. આ ઉપરાંત આખા વર્ષ દરમ્યાન સરેરાશ દિવસોમાં પણ કાયમી ભેજનું પ્રમાણ ૫૦% થી ઉપર નોંધાય છે. તથા વર્ષનો સરેરાશ વરસાદ પણ જુન થી સપ્ટેમ્બર માસ દરમ્યાન ૭૮૦ મી.મી. જેટલો નોંધાય છે. આ બધી અનુકૂળતાઓનાં કારણે મંદ્ર ઉત્પત્તિ અને મંદ્રજન્ય રોગો જેવા કે મેલેરીયા, તેન્યું, ચીકનગુનિયાનાં કેસો અમદાવાદ શહેરમાં છેતું પ્રમાણે પ્રવર્ત્માન છે.

### (૪) મંદ્રના ઉત્પત્તિ સ્થાનો :-

અમદાવાદ શહેરમાં મેલેરીયા, તેન્યું, ચીકનગુનિયા રોગોને ફેલાવતાં મંદ્રરો ઘર, ઓફિસ કે સંસ્થાકીય મકાનોમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકીઓ, એરકુલર, રેશીજરેટર, હુલડાની, કન્સ્ટ્રક્શન સાઇટ, ખાડા, ખાબોચીયા, કે મકાનમાં રાખી મુકવામાં આવેલ કોઈપણ ભંગારમાં ભરાય રહેલા પાણીમાં પેદા થાય છે. અમદાવાદ શહેરમાં એન્ટોમોલોજીકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવતા, સમગ્ર અમદાવાદ શહેરમાં નીચે મુજબ મંદ્રના ઉત્પત્તિ સ્થાનો મળી આવેલ હતા. મંદ્રજન્ય રોગો જેવા કે મેલેરીયા, તેન્યું, ચીકનગુનિયા રોગનાં મંદ્રરો ચોખા પાણીમાં પેદા થતા હોઈ આ રોગને ફેલાતો અટકાવવા માટે ઘર / ઓફિસ વિગેરેમાં ઉપયોગ કરવામાં આવતાં પાણી સંગ્રહીત પાત્રો જેવા કે માટલું, કોઠી, પીપ, ઓવર હેડ ટેન્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક, સ્કેપ વિગેરેનો નિયમીત ધોરણે સર્વે હાથ ધરી મંદ્રનાં પોરાનો નાશ કરવો તે વિકલપ જ યોગ્ય ગણાય છે. જ્યારે ગંદા પાણીમાં પેદા થતા ક્યુલેક્શ મંદ્ર જે ફક્ત ગ્રાસદાયી મંદ્ર હોઈ રોગ ફેલાવા માટે સક્ષમ નથી.



### (૫) મંદ્રજન્ય રોગોના પ્રકાર અને લક્ષણો:-

**મેલેરીયા :-** માદા એનોફીલીસ મચ્છર મેલેરીયા દર્દને કરડીને ચેપી બને છે. અને જે તંદુરસ્ત વ્યક્તિને કરડે તે વ્યક્તિ ચેપી બની જાય છે અને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા રોગનો દર્દી બની જાય છે. મેલેરીયા મુખ્યત્વે ચાર પ્રકારના છે. જેમાં મુખ્યત્વે પી.વાયવેક્સ અને પી.ફાલ્સીફારમ અમદાવાદ શહેર માટે મુખ્યત્વે જવાબદાર પરોપજીવી છે. વર્ષ દરમ્યાન નોંધાતા મેલેરીયાના કેસોમાં પી.વાયવેક્સનું પ્રમાણ ૭૦% અને પી.ફાલ્સીફારમના કેસોનું પ્રમાણ ૩૦% હોય છે. મેલેરીયાથી થતા મૃત્યુમાં મોટાભાગે મરણ પી.ફાલ્સીફારમના કારણે નોંધાય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષના આંકડા તપાસતાં પી.વાયવેક્સના કિસ્સામાં પણ મૃત્યુ આંક નોંધાયેલ છે.

#### ➤ મેલેરીયા રોગ ના લક્ષણો :-

ટાઈ ચઢીને તાવ આવવો. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય. તાવ ઉત્તરે ત્યારે પુષ્કળ પરસેવો વળવો. ઉલ્ટી કે ઉબકા આવવા. ભુખ ન લાગવી, પેટમાં સખત દુઃખાવો, બેભાન અવસ્થા.

છેલ્લા ૧૬ વર્ષની સરેરાશ સાદા મેલેરીયા અને ઝેરી મેલેરીયાનાં કેસોની સીઝન પ્રમાણે સીઝનાલીટીનો જોતા માલુમ પડે છે કે સાદા મેલેરીયાનાં કેસો માછે જાન્યુઆરી થી માર્ચ માસ દરમ્યાન સરેરાશ અને માછે એપ્રિલ થી ઓક્ટોબર માસ દરમ્યાન મહત્તમ નોંધાય છે. જ્યારે ઝેરી મેલેરીયાનાં કેસો માછે ઓગષ થી ડિસેમ્બર માસ દરમ્યાન મહત્તમ નોંધાય છે. આ સમયગાળા દરમ્યાન દર્દાઓનાં મૃત્યુ થવાની સંભાવનાં વધારે રહે છે.

**દેન્યું :-** દેન્યુનો તાવ એડીસ મચ્છર કરડવાથી દેન્યુ વાયરસથી થતો રોગ છે. દેન્યુ વાયરસ મુખ્યત્વે ચાર પ્રકારના છે.

#### ➤ દેન્યુ તાવના લક્ષણો:-

દેન્યુ તાવનાં લક્ષણોમાં મુખ્યત્વે મોટાભાગના કિસ્સાઓમાં એસીન્ટોમેટીક સ્ટેજ, અમુક કિસ્સાઓમાં દેન્યુ ફીવર અને ૩% થી ૪% કિસ્સાઓમાં દેન્યુ હેમરેજક ફીવર અને ૧% થી પણ ઓછા કિસ્સામાં દેન્યુ શોક સીન્ફ્રોમના લક્ષણો દેખાય છે. અચાનક તાવ, ખુબ શરીર દુઃખે, માથું દુઃખે, અંખની પાછળ દુઃખે, ઉલ્ટી, ઓછો પેશાબ, ચક્કર, રતાશ પડતા લોહીવાળા ડાધ, ચામડીમાં લોહી જરવાથી થાયછે. દેન્યુ ફીવરમાં હાડકાનો દુઃખાવો પુષ્કળ થવાથી તેને બ્રેક બોન ફીવર પણ કહે છે. દેન્યુ શોક સીન્ફ્રોમમાં મૃત્યુની શક્યતાઓ પણ વધારે છે.

## DENGUE PREVALENCE

YEAR	SERUM SAMPLES TESTED	DENGUE POSITIVES	SERO POSITIVITY (%)	DEATHS
2006	903	146	16.2	7
2007	1826	220	12.0	10
2008	2579	326	12.6	8
2009	2116	265	12.5	4
2010	4309	574	13.3	5
2011	6053	612	10.1	5
2012	5942	513	8.6	7
2013	8848	677	7.6	4
2014	8246	638	7.7	1

દેન્ગુ રોગ ભૂપૃષ્ઠ રીતે આ ક્ષેત્રમાં મળી આવતો અને ફેલાતો રોગ છે. શંકાસ્પદ તાવનાં દર્દીઓનાં મેળવવામાં આવતાં લોહીના નમુના પૈકી લગભગ ૧૦% થી ૧૨% દેન્ગુ પોઝિટિવ કેસો નોંધાતાં હોઈ છે. સને ૨૦૦૬ થી ૨૦૧૪ દરમ્યાનની સ્થિતી ઉપરનાં કોષ્ટકમાં જોઈ શકાય છે. તમામ વર્ડ અર્બન હેલ્થ સેન્ટરો / રેફરલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.માં આવતાં તાવનાં દર્દીઓ પૈકી શંકાસ્પદ દેન્ગુ તાવનાં દર્દીઓનો લોહીનો નમુનો મેળવવા આવે છે. દર વર્ષ વધારો કરવામાં આવતો હોઈ સને ૨૦૦૬ થી ૨૦૧૪ દરમ્યાન ૮ ગણા જેટલો વધારે છે. મેલેરીયા વિભાગનાં સંકલન દ્વારા એન.એચ.એલ.મેડીકલ કોલેજ, બી.જે.મેડીકલ કોલેજ, સોલા સ્થિવિલ મેડીકલ કોલેજ તેમજ એલ.જી.હોસ્પિટલ અને શા.ચી.લા.હોસ્પિટલ ખાતે દેન્ગુ પરિક્ષણ કરાવવામાં આવે છે.

**ચિકનગુનિયા:-** ચિકનગુનિયા એ અર્બો વાયરસથી થતો રોગછે. જે ચેપી “એડીસ ઈજ્ઞપ્ટી” મથુરનાં કરડવાથી થાયછે.

### ► ચિકનગુનિયા તાવના લક્ષણો:-

સખત તાવ આવવો.

હાથ પગના સાંધા જકડાઈ જવા.

ઉલ્ટી કે ઉબકા આવવા.

શરીર ઉપર રતાશ પડતા ચકામાં ઉપસી આવવા.

## અમદાવાદ શહેરમાં મેલેરીયાનું પ્રમાણ :-

સને ૧૯૬૧ થી લઈને ૨૦૧૪ સુધીના મેલેરીયા રોગનું પ્રમાણ દરાવિલ ગ્રાફમાં જોઈ શકાય છે (પાના નં.-૪). આ રોગ અમદાવાદ શહેરની કાયમી બિમારી છે. અને પાછળા વર્ષોમાં સાદા મેલેરીયાનું પ્રમાણ ઉચ્ચ રહેલ છે, પરંતુ હાલના વર્ષમાં જેરી મેલેરીયા(પી.ફાલ્સીપારમ)નું પ્રમાણ વધતું જાય છે. સાથે સાથે મરણનું પ્રમાણ પણ ઉચ્ચ રહેવા પામેલ છે. છેલ્લા ૧૫ વર્ષના આંકડાઓ જોતા એપ્રીલથી જુનમાં સાદા મેલેરીયાનાં કેસોમાં જે વધારો જોવા મળેલ છે તે રીલેપ્સ કેસ હોવાની શક્યતા હોય છે. અને ઓગષ્ટ થી નવેમ્બરમાં જે સાદા મેલેરીયાનાં કેસમાં જે વધારો જોવા મળેલ છે તે સીજનમાં ઉપદ્રવ પામતા મય્યરોને કારણે હોય છે. અને જેરી મેલેરીયામાં સાફેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન વધારો જોવા મળે છે.


### મેલેરીયા-મેટ્રીક્સ ઇન્ડેક્સિસ :-

AMC: MALARIOMETRIC INDEX – ABER*				
Yr '20	BSE	Pf	Total +ves	ABER
01	185790	948	4615	5.3
02	159623	651	4251	4.4
03	194438	1116	5444	5.3
04	270933	2314	7402	7.3
05	457055	2759	8593	12.0
06	533300	2217	6054	14.0
07	477397	2100	5224	9.9
08	542922	1371	5296	11.2
09	600289	1022	5677	11.6
10	584278	1920	7193	10.6
11	594308	3658	13531	10.7
12	791444	2898	18802	14.0
13	953595	1936	12680	17.6
14	903927	1123	7152	15.0

- ABER : અન્યુલ બ્લડ એક્જામીનેશન રેટ: ( ટોટલ મેલેરીયા પોઝિટીવકેસ ★ ૧૦૦)

મધ્યવર્તી વસ્તી નેશનલ ટર્ગેટ મુજબ અન્યુઅલ બ્લડ એક્જામીનેશન રેટનું પ્રમાણ વાર્ષિક ૧૦% જેટલું હોય છે. RCH કાર્યરત કર્યા પહેલા આ પ્રમાણ ૫.૬% હતું, પરંતુ RCH બાદ આ પ્રમાણ ૧૧.૬% થયેલ છે. અને છેલ્લા બે વર્ષ માં કેસોમાં પણ ખુબજ વધારો જોવા મળેલાછે. (૫૦% વધારો જોવા મળેલાછે). વર્ષ ૨૦૧૪ દરમ્યાન મહત્તમ બ્લડ સ્મીયર કલેક્શન અને નિરિક્ષણ ઉપર વિશેષ ભાર મુકવામાં આવેલ અને આશરે ૮,૦૩,૬૨૭ જેટલા બ્લડ સ્મીયર તપાસવામાં આવેલ છે.

દેન્યુનાં કેસોની સીરીઝન પ્રમાણે સીરીઝનાલીટીનો ગ્રાફ નીચે દર્શાવવામાં આવેલ છે.



માહે ઓગષ્ટ થી ડિસેમ્બર માસ દરમ્યાન દેન્યુનાં કેસો મહત્તમ જોવા મળે છે. આ સમયગાળા દરમ્યાન ઘરવપરાશી પાણી સંગ્રહીત પાત્રો જેવા કે માટલું, કોઠી, પીપ તેમજ ઓવર હેડ ટેન્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક, સ્કેપ વિગેરેને હવા શુસ્ત ઢાંકણથી કે તાડ પતરીથી ઢાંકીને રાખવા ઉપરાંત દેન્યુનું તાવનો મશ્શર દિવસ દરમ્યાન કરડતો હોવાથી તેનાથી બચવા માટે દિવસ દરમ્યાન પણ મશ્શરદાનીનો ઉપયોગ, મોસ્કીટો રિપેલન્ટ ક્રીમ, ઓઈલ, અગરબત્તી વિગેરે જેવા વ્યક્તિગત રક્ષણ અપનાવવું તે હિતાવહ છે.

- મેલેરીયા સ્લાઇડ પોઝિટીવ રેટ:- **SPR** (સ્લાઇડ પોઝિટીવ રેટ)

(ટોટલ મેલેરીયા પોઝિટીવ કેસ\*૧૦૦/ટોટલ બ્લડ સ્મીયર).

સમગ્ર શહેરમાં ૨૦૦૧ થી ૨૦૦૪ સુધી પોઝિટીવ રેટ ૨.૭% જેટલો હતો. જે RCH કાર્યરત કર્યા બાદમાં કેસો માં ઘટાડો જોવા મળેલ છે. ૨૦૧૪ના વર્ષમાં સ્લાઇડ પોઝિટીવ રેટ ગત વર્ષની સરખામણીએ વધારો નોંધાયેલ છે. બ્લડ સ્મીયર કલેક્શનમાં વધારો થતા મેલેરીયાનાં કેસો વધારે ડિટેક્ટ થયેલ છે.

### AMC: MALARIOMETRIC INDEX – SPR\*

Yr '20	BSE	Total +ves	SPR
01	185790	4615	2.5
02	159623	4251	2.7
03	194438	5444	2.8
04	270933	7402	2.7
05	457055	8593	1.9
06	533300	6054	1.1
07	477397	5224	1.1
08	542922	5296	0.9
09	600289	5677	0.9
10	584278	7193	1.2
11	594308	13531	2.3
12	791444	18802	2.4
13	953595	12680	1.3
14	903927	7152	0.79

• SPR\*: Slide Positivity Rate – Total Malaria Positives \* 100 / Total Blood Smear

Examined (BSE) – Indicate percent positives of malaria cases – better indicator to know malaria transmission intensity, excluding time period.

• Post RCH period it halved in spite of inclusion of newly merged area

વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૪ દરમ્યાન બ્લડ સ્મીયર કલેક્શનમાં વધારો નોંધાયેલ છે તેની સામે મેલેરીયા કેસોમાં પણ ઘટાડો નોંધાયેલ અને સ્લાઇડ પોઝિટીવીટી રેટ પણ ગત વર્ષની સરખામણીએ ઘટેલ છે. જે દરશાવે છે કે કોઈ રોગચાળો નથી પરંતુ રોગ પરિક્ષણ સુવિધામાં સુધારો નોંધાયેલ છે.

- સ્લાઇડ ફાલ્સીપારમ રેટ:- **SFR**(સ્લાઇડ ફાલ્સીપારમ રેટ):

(કુલ ઝેરી મેલેરીયા ના કેસો\*૧૦૦/કુલ તપાસેલ બ્લડ સ્મીયર.)

સમગ્ર શહેરમાં ૨૦૦૧ થી ૨૦૦૪ સુધી પોઝિટીવ રેટ ૦.૬% જેટલો હતો. જે RCH કાર્યરત કર્યા બાદમાં કેસોમાં ઘટાડો જોવા મળેલ છે. ૨૦૧૩ની તુલનામાં ૨૦૧૪ના વર્ષમાં ઝેરી મેલેરીયાનાં કેસોમાં ઘટાડો(વર્ષ

૨૦૧૩માં ૧૯૩૬ ની સામે વર્ષ ૨૦૧૪માં ૧૧૨૩ અને સ્લાઇડ ફાલ્સીપારમ રેટ વર્ષ ૨૦૧૩ ની સરખામણીએ વર્ષ ૨૦૧૪ દરમ્યાન ૫૮ % જેટલો ઘટાડો છે.

### AMC: MALARIMETRIC INDEX – SFR\*

ફેદું	BSE	Pf	SFR
01	185790	948	05
02	159623	651	04
03	194438	1116	06
04	270833	2314	08
05	457055	2759	06
06	533300	2217	04
07	477397	2100	04
08	542922	1371	02
09	600289	1022	02
10	584278	1920	03
11	594303	3658	06
12	791534	2897	03
13	953595	1936	02
14	903927	1123	012

•SFR : Slide Fallopium Rate—Total Pf cases \* 100 / Total Blood Smear Examined(BSE)—Indicate percent positives of Pf cases—better indicator to know Pf transmission intensity excluding time period.

•Post RCH period it halved in spite of inclusion of newly negl area

•During previous two years 2011 & 2012, Pf cases had doubled (since April 2010 New National Drug Policy was implemented including Fever Paroxysmal Treatment which was in operation since 1997)

### મેલેરીયા રોગનું RCH અને હોસ્પિટલ સાથે સરખામણી :-

વર્ષ ૨૦૧૨ દરમ્યાન હોસ્પિટલોમાં આશરે ૨.૮૭ લાખ , વર્ષ ૨૦૧૩ દરમ્યાન સામાન્ય વધારા સાથે ૩.૫૮ લાખ બ્લડ સ્મીયર કલેક્શન નોંધાયેલ છે અને ૨૦૧૪ દરમ્યાન ૪.૬૩ લાખ બ્લડ સ્મીયર કલેક્શન નોંધાયેલ છે. સ્લાઇડ પોઝિટિવિટી રેટ વર્ષ ૨૦૧૨ દરમ્યાન ૨.૫% , વર્ષ ૨૦૧૩ દરમ્યાન ૧.૪૩% અને ૨૦૧૪ દરમ્યાન ૦.૭૫ નોંધાયેલ છે. જ્યારે RCH ખાતે વર્ષ ૨૦૧૨ દરમ્યાન ૪.૮૩ લાખ બ્લડ સ્મીયર કલેક્શન અને ૧૧૩૮૨ મેલેરીયાનાં કેસો નોંધાયેલ છે. સને ૨૦૧૪માં ૪.૪૦ લાખ બ્લડ સ્મીયર કલેક્શન અને ૭૫૩૩ મેલેરીયાનાં કેસો નોંધાયેલ છે. એ દરાવિં છે કે હોસ્પિટલની સરખામણીએ RCH અંતર્ગત ડિટેક્શન વધુ સારુ રહેલ છે. કોઈક નીચે દરાવિં છે. કુલ ૩૦૦ એમ.પી.એચ.ડબલ્યુ. ની નવી ભરતી કરી સમગ્ર શહેરનાં નોન સ્લમ વિસ્તારમાં તથા લીક વર્કરોની સંખ્યામાં ૧૦૦૦ થી વધારો કરી ૧૫૫૦ કરવામાં આવી, હાલમાં ૧૩૦૦ જેટલા

વર્કરો દ્વારા ફિવર સર્વેલન્સની કામગીરી સધન કરવામાં આવી તે બાબત RCH નાં પરિણામમાં અસરકારક રહેલ છે. સામાન્ય રીતે RCH દ્વારા ૬૦% અને હોસ્પિટલ દ્વારા ૪૦% મેલેરીયાનાં કેસો ડિટેક્ટ કરવાનાં હોઈ છે પરંતુ પાછળા વર્ષો દરમ્યાનનાં આંકડા ઉપર નજર કરતાં RCH ની ફાળવણી હોસ્પિટલની કક્ષાએ ઓછી નોંધાતી રહેલ. વર્ષ ૨૦૧૩ માં RCH ની ફાળવણી ૬૧% અને હોસ્પિટલની ઉદ્ઘાટન વર્ષ ૨૦૧૪ દરમ્યાન RCH ની ફાળવણી ૪૮% અને હોસ્પિટલની ૫૧% જેટલી નોંધાયેલ છે.

YEAR	RCH – UHCs			PCD HOSPITALS		
	BSE	MALARIA CASES	SPR	BSE	MALARIA CASES	SPR
2005	341542	4907	1.4	115513	3686	3.2
2006	397355	2818	0.7	145945	3236	2.2
2007	336329	2926	0.9	142287	2308	1.6
2008	382488	3370	0.9	161028	2005	1.3
2009	400630	3481	0.9	199659	2196	1.1
2010	352820	3981	1.1	231458	3212	1.4
2011	334202	7158	2.1	260106	6373	2.3
2012	493832	11382	2.3	297611	7420	2.5
2013	594661	7533	1.27	358934	5147	1.43
2014	440815	3657	0.83	463112	3495	0.75

• Since 2005 the trend of malaria positivity was declining in both the independent agencies.

• 2010 onwards the cyclical increasing trend has set up showing rising cases in both agencies; Fever Radical Treatment was withdrawn from April 2010 onwards.

### લીક વર્કરની કામગીરી:-



સમગ્ર અમદાવાદ ની ૫૫.૬ લાખની વસ્તીની સામે લીક-વર્કર દ્વારા મેલેરીયાની કામગીરી માટે ૩૪ લાખ વસ્તી કવર કરવામાં આવે છે. લીક વર્કરો દ્વારા કરવામાં આવતી કામગીરીમાં વર્ષ ૨૦૧૩ માં થયેલ સુધારો નીચેનાં કોષ્ટક ઉપરથી સાભીત થાય છે. લીક વર્કરોને સ્લાઇડ કલેક્શન માટે રૂ.૫/- ઈન્સેન્ટીવ આપવા આવે છે. માસવાઈઝ આંકડાકીય સ્થિતીનું વિશ્લેષણ કરતા માલુમ પડેલ છે કે ચોમાસાની ટ્રાન્સમિશન પીરીયડ માહે ઓગાઝ પહેલાં જ અસરકાર ડિટેક્શનનાં પરિણામ સ્વરૂપે પી.ફાલ્સીપારમમાં ઘટાડો નોંધાય છે.

## RCH ANALYSIS - Link Workers Performance

<b>YEAR</b>	<b>Blood Smear Collected by LWs</b>	<b>P vivax</b>	<b>P falciparum</b>	<b>Total Malaria Cases Detected</b>
<b>2007</b>	<b>252663</b>	<b>723</b>	<b>49</b>	<b>1192</b>
<b>2008</b>	<b>286693</b>	<b>842</b>	<b>220</b>	<b>1062</b>
<b>2009</b>	<b>296738</b>	<b>857</b>	<b>186</b>	<b>1043</b>
<b>2010</b>	<b>249605</b>	<b>752</b>	<b>184</b>	<b>936</b>
<b>2011</b>	<b>219741</b>	<b>1119</b>	<b>32</b>	<b>1471</b>
<b>2012</b>	<b>329918</b>	<b>1967</b>	<b>89</b>	<b>2056</b>
<b>2013</b>	<b>303322</b>	<b>785</b>	<b>67</b>	<b>852</b>
<b>2014</b>	<b>185842</b>	<b>136</b>	<b>16</b>	<b>152</b>

સમગ્ર અમદાવાદ શહેરને ફીવર સર્વે તથા ઈન્ટ્રોમેસ્ટીક સર્વેમાં આવરી લેવાની જરૂરીયાત જણાય છે.

આગામી અમદાવાદ શહેરમાં મેલેરીયા કેસોના આંકડા સને-૧૯૯૧થી એકત્રીત કરવામાં આવે છે અને પાછળા વર્ષોમાં સાદા મેલેરીયા કેસોનું પ્રમાણ ઉચ્ચ જોવા મળેલ છે પરંતુ છેલ્લા ૨૦ વર્ષોમાં મેલેરીયાના કેસોનું પ્રમાણ વધુ જણાય છે અને મૃત્યુનું પ્રમાણ પણ ઉચ્ચ રહેવા પામેલ છે જે નીચેના ગ્રાફમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે. મેલેરીયાની સીજનાલીટીનો ગ્રાફ જોતાં જન્યુઆરીથી ડિસેમ્બર સુધી માસવાઈજ છેલ્લા ૧૬ વર્ષમાં એટલે કે ૧૯૯૭ થી એવરેજ મેલેરીયાના કેસોને ધ્યાન લઈએ તો સાદા મેલેરીયાના કેસો વધવાની શરૂઆત એપ્રિલથી શરૂ થાય છે અને વધુ કેસો ઓગષ્ટ, સપ્ટેમ્બર માસમાં નોંધાયેલ છે. જ્યારે ઝેરી મેલેરીયાના કેસોમાં વધવાની શરૂઆત માહે ઓગષ્ટ થી ચાલુ થાય છે અને માહે ઓક્ટોભર થી નવેમ્બર માસમાં સૌથી વધુ કેસોનોંધાયેલ છે.



## સને ૨૦૧૫ માટેનું આયોજન :-

આર.સી.એચ.યોજના હેઠળ તમામ વોર્ડ ખાતે કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરો ખાતેનાં લીક વર્કરો મારફતે શહેરની આશારે ઉઠ લાખ જેટલી વસ્તીને ઘરે ઘરે ફરીને મેલેરીયા રોગની સારવાર અને સુવિધા પુરી પાડવામાં આવે છે. આ સુવિધા બાકી રહેતી સમગ્ર શહેરની વસ્તીને પુરી પાડવા માટે નીચે મુજબ આયોજન કરવામાં આવેલ છે.

1. લીક વર્કરોની સંખ્યામાં ૧૦૫૦ થી વધારો કરી ૧૫૫૦ જેટલી કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા ચાલુ હોઈ આજની સ્થિતીએ ૧૪૦૦ વર્કરો ઉપલબ્ધ છે.
2. સમગ્ર શહેરની વસ્તીને આ સુવિધા પુરી પાડવા માટે અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કુલ ૭૦૦ જેટલા મલ્ટીપરપઝ હેલ્થ વર્કરોની નવી નિમણૂંક કરવામાં આવી. પ્રતિ વર્કર ૬,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલી વસ્તી કવર કરી ઘરે ઘરે ફરીને સમયસર ૧૫ દિવસમાં એક વખત મર્યાદાનાં પોરાનાશક કામગીરી, રોગ વિષયક જાગૃતિ તેમજ મેલેરીયા રોગની રેડીકલ સારવાર પુરી પાડશે.
3. ૧૫૫૦ લીક વર્કરો હાલમાં શહેરની ઉઠ લાખ સ્લમ વિસ્તારની વસ્તીમાં સેવા આપી રહેલ છે. જ્યારે નોન સ્લમ વિસ્તારને પણ આવરી લેવા માટે ઉઠ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની જરૂર છે જે પખવાડીક ધોરણે જે તે વિસ્તારને મર્યાદાનાં પોરાનાશક અને ફિવર સર્વેલાન્સની કામગીરી અંતર્ગત આવરી લેશે. આ પૈકી જુલાઈ-૨૦૧૩ થી ૨૫૨ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની નિમણૂંક કરી જરૂરી તાલીમ આપી પોસ્ટીંગ કરી દેવામાં આવેલ છે. સદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેથી અમદાવાદ શહેરનાં સ્લમ અને નોન સ્લમ વિસ્તારમાં પખવાડીક ધોરણે કામગીરી નિયમીત બનાવી દેવામાં આવશે.
4. તદુપરાંત હાલમાં કાર્યરત તમામ ૬૧ વોર્ડ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે ઓ.પી.ડી. સેવામાં મેલેરીયા નિદાન અને સારવારની આ સુવિધા ઉપલબ્ધ રાખેલ છે જે યથાવત રહેશે. વર્ષ ૨૦૧૪ દરમાન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો દ્વારા થયેલ કામગીરીનું ઝોનવાઈઝ પત્રક નીચે મુજબ છે.

MPHWs : SURVEILLANCE PERFORMANCE ZONE WISE- 2014			
MONTH	RDTKs tested	PV	PF
CENTRAL	7490	6	0
WEST	26159	6	0
NORTH	27689	37	29
EAST	17232	13	0
SOUTH	27193	12	1
NEW WEST	11126	12	2
<b>TOTAL</b>	<b>116889</b>	<b>86</b>	<b>32</b>

**MPHWs were recruited , trained and posted since July 2012**

ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ તમામ જોનનાં કુલ ૬૪ વોર્ડ વિસ્તારનાં બીટ પત્રકો બનાવી દેવામાં આવેલ હોઈ કુલ ૩૪૮ બીટમાં પબ્લિક હેલ્પ વર્કરો દ્વારા પખવાડીક ધોરણે સમગ્ર શહેર / વસ્તી આવરી લેવામાં આવશે. આ વર્કરોની નિમણૂંક કાર્યવાહી પ્રગતિ હેઠળ હોઈ નિમણૂંક થયેથી જરૂરી ટ્રેનીંગ આપવાનું પણ આયોજન કરી દેવામાં આવેલ છે (૪ દિવસ જોનલ કક્ષાએ, ૭ દિવસ અ.એ.સે. ઉપર મેરીકલ ઓફિસર દ્વારા). મલ્ટી પર્ઝ હેલ્પ વર્કરો મારફતે તાવનાં દર્દીને સ્થળ ઉપર જ ૧૫ મીનીટનાં સમયમાં ત્વરિત નિદાન અને સારવાર પુરી પાડવાનાં હેતુથી ગત વર્ષ થી રેપીડ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ કીટ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. આ વર્કરોની નિમણૂંક થયેથી લોહીના નમુનાની સંઘામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ લેબોરેટરી ખાતે રિટાઇર અથવા કામગીરીનાં અનુભવી અથવા નામાંકિત પેથોલોજ લેબોરેટરી મારફતે પ્રતિ લોહીનો નમુનો રૂ. ૫/- લેખે મેલેરીયા પરિક્ષણ કરાવવા માટે સક્ષમ સત્તાની મંજુરી મળેલ છે.

### **-: મેલેરીયા રોગ નિદાન માટે જરૂરી આયોજન :-**



વિશેષ કરીને મ્યુ.જનરલ હોસ્પિટલો જેવી કે શેઠ.લ.ગો., શેઠ વા.સા. અને શ્રીમતી શા.ચી.લા. ખાતે ચોમાસાની મેલેરીયા રોગની પીક સીજન દરમ્યાન (જુન થી નવેમ્બર) તાત્કાલીક નિદાન અને સારવાર મળી રહેતે માટે અલગથી ફિવર કલીનીક કાર્યરત કરવાની તેમજ મેલેરીયા રોગનાં દર્દીને નેશનલ ટ્રોગ પોલીસી-૨૦૧૫ અનુસાર સંપૂર્ણ સારવાર મળે, મરણનાં કેસોમાં મેરીકલ ઓડિટ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન ફોર્મ ભરવામાં આવે તેવી વ્યવસ્થા જવાબદાર સબંધિત હોસ્પિટલનાં મેરીકલ સુપ્રિન્ટેન્નેન્ટ અને પ્રિવેન્સન એન્ડ સોસીયલ મેરીકલ ડિપાર્ટમેન્ટ(મ્યુ. મેરીકલ કોલેજ)ની રહેશે. એપીડેમીક સેલ દ્વારા માણે ઓગષ્ટ-૨૦૧૧ થી શહેરની ૭૮ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલો/કલીનીક્સ ખાતેથી ઓનલાઈન માહીતી મેળવવાનું શરૂ કરવામાં આવેલ છે. હાલમાં ૧૬૫ રિપોર્ટિંગ યુનિટ છે. જેના આધારે જે તે વિસ્તારમાં સમયસર રોગ અટકાયતી પગલાં લઈ રોગ પ્રસારને અટકાવવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. આ સુવિધાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે વધુ પ્રાઈવેટ હોસ્પિટલો / કલીનીક્સને સમાવી લેવાની જરૂર છે.

### **-: અ.મ્યુ.કો. હણનો ફરતો પરા વિસ્તારમાં મય્યરનાં પોરાનાશક કામગીરી માટેનું આયોજન :-**

હાલમાં ઉપલબ્ધ કુલ ૮૫ શીડ્યુલનાં કાયમી મજુરો ઉપરાંત ૩૩૦ રોજંદા પાર્ટ/કુલ ટાઈમ વર્કરો રાખવામાં આવેલ છે. મજુરો દ્વારા પેરિડોમેર્સ્ટીક મય્યરનાં પોરાનાશક કામગીરી, પુખ્ત મય્યરનાશક ધૂમાડાની કામગીરી, કન્સ્ટ્રક્શન સાઈટ્સ સર્વેની કામગીરી, પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવશે.

### **ઈન્ડોર રેસીડિયુઅલ સ્પ્રે :-**

અ.ભ્ય.કો. વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન મેલેરીયાનાં કેસો નીચેનાં ગ્રાફમાં દર્શાવવામાં આવેલ છે.



શહેરમાં આવેલ કોમર્શીયલ, ધંધાકીય એકમોવાળા વિસ્તારને બાદ કરતા (મધ્ય ઝોન) બાકી તમામ ઝોનમાં મેલેરીયા રોગ પ્રવર્તમાન છે, પરંતુ દક્ષિણ અને પૂર્વ ઝોન વિસ્તારમાં મેલેરીયા રોગનું પ્રમાણ વધારે રહેલ છે. આ તમામ ઝોન વિસ્તારમાં લોગટર્મ એક્શન ખાન અંતર્ગત હાઈરિસ્ક વિસ્તારનાં તમામ ઘરોને ઈન્ડોર રેસીડિયુઅલ સ્પે હેઠળ આવરી લેવામાં આવે તો તેની અસર મળે તેમ છે. માછે મે થી નવેમ્બર-૨૦૧૪ દરમ્યાન બે તબક્કામાં શહેરનાં ૧૦,૮૭,૫૪૨ લાખ ઘરોનાં લક્ષ્યાંક પૈકી ૮,૨૨,૫૮૨ લાખ ઘરોને ઈન્ડોર રેસીડિયુઅલ સ્પે હેઠળ આવરી લેવામાં આવેલ, જેની અસર સપ્ટેમ્બર માસ દરમ્યાનથી મેલેરીયા રોગનાં કેસોમાં નોંધાયેલ સતત ઘટાડો દર્શાવે છે. વર્ષ ૨૦૧૫ દરમ્યાન પણ આ કામગીરીનાં બે રાઉન્ડ હાથ ધરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

## વર્ષ ૨૦૧૫ દરમ્યાન તમામ જોન વાઈજ આઈ.આર.એસ. કામગીરીનું આયોજન પત્રક.

ZONE	High Risk Area Dwellings planned for coverage
CENTRAL	1,13,369
WEST	80,264
NORTH	1,09,439
EAST	1,95,425
SOUTH	1,36,076
NEW WEST	1,51,034
Total City	7,85,607

વર્ષ ૨૦૧૨ દરમ્યાન ઈન્ડોર રેસીડિયુઅલ સ્પેની કામગીરી અ.મ્યુ.કો. વિસ્તારમાં સૌ પ્રથમ વખત કરવામાં આવેલ. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં માહે મે થી જુલાઈ (ત્રણ માસ) દરમ્યાન ૪.૩૬ લાખ ઘરો અને દ્વિત્ય તબક્કામાં માહે ઓગષ્ટ થી નવેમ્બર (ચાર માસ) દરમ્યાન ૫.૭૨ લાખ ઘરો આવરી લેવામાં આવેલ. આ કામગીરી થી મહત્તમ અસર અને મચ્છર / મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે મહત્તમ અસરકારકતા મળી રહે તે હેતુથી ચાલુ વર્ષ દરમ્યાન પ્રથમ તબક્કામાં માહે મે થી જુલાઈ તથા ઓગષ્ટ થી ઓક્ટોભર-૨૦૧૫ દરમ્યાન આ કામગીરી સધન રીતે હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

### એન્ટોમોલોજીકલ સર્વેલન્સ :-

વર્ષ ૨૦૧૧ સુધી ટ્રેઇન્ડ થયેલ ઈન્સેક્ટ કલેક્ટર ઉપલબ્ધ ન હોઈ આ કામગીરી રોજંડા વર્કરો દ્વારા કરાવવામાં આવતી હતી. વર્ષ ૨૦૧૨ દરમ્યાન મલ્ટી પર્ફેં હેલ્પ વર્કરોની ભરતી કરવામાં આવતાં જરૂરી તાલીમબધ્ય કરી પ્રતિ વોર્ડ ૨ દીઠ કુલ ૧૨ વર્કરો દ્વારા એન્ટોમોલોજીકલ સર્વેની કામગીરી નિયમીત બનાવી દઈ દરેક વોર્ડ વિસ્તારમાં પખવાડીક ધોરણે મોનીટરીંગ થઈ રહેલ છે. વોર્ડ વાઈજ તમામ વોર્ડ ખાતે મચ્છરની ઘનતા મોનીટરીંગ કરવા માટેનું આયોજન નીચે મુજબ છે. પ્રતિ જોન ૧ દીઠ કુલ ૬ જુની.આસી.એન્ટોમોલોજીસ્ટ અને વર્લ્ડ બેંકનાં મેલેરીયા કન્ટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ડિયન રેડ કોસ સોસાયટીનાં માધ્યમથી પ્રતિ જોન દીઠ ૧ મુજબ ૬ મેલેરીયા ટેકનીકલ સુપરવાઈઝરોની નિમણૂંક કરી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેલેરીયા રિસર્ચ સેન્ટર, નડિયાદ દ્વારા જરૂરી તાલીમ પુરી પાડી જે તે જોન ખાતે પોસ્ટીંગ કરી દેવામાં આવેલ છે. તદઉપરાંત હાલમાં ડિસ્ક્રીક્ટ વેક્ટર બોર્ડ ડિસીઝ કન્સલ્ટન્ટ(૧) ની નિમણૂંક કરવામાં આવેલ છે. પ્રતિ જોન દીઠ બે ઈન્સેક્ટ કલેક્ટર(પબ્લીક હેલ્પ વર્કર કક્ષાનાં), ૨- મજુરો દ્વારા દૈનિક ધોરણે પ્રતિ વોર્ડ ૪ ઘરોમાં મચ્છર ઉન્સીટી મોનીટરીંગ કરેશે. જેથી પખવાડીક ધોરણે તમામ વોર્ડની એડલ્ટ તેન્સીટી હેઠળ આવરી શકાય.

### -: તળાવોની વેજીટેશનમુક્ત જાળવણી :-

શહેરમાં આવેલ ૧૦ જેટલા તળાવોમાં મચ્છર ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા માટે વર્ષ ૨૦૦૭-૨૦૦૮ થી સક્ષમ સત્તાની મંજુરીથી તળાવને વેલ / અન્ય વનસ્પતિ / તરતા કચરાથી મુક્ત રાખી કામગીરીનાં જાગ્રાકાર, અનુભવી કોન્ટ્રાક્ટરો મારફતે વાર્ષિક ધોરણે તળાવોની જાળવણી કરાવવામાં આવી રહેલ છે. જેથી કરીને ગ્રાસદાખી મચ્છર તરીકે ઓળખાતા ક્યુલેક્ષ મચ્છર ઉપદ્રવ કાબુ હેઠળ રાખી શકાય.

વાર્ષિક ધોરણે ત્રીજા વર્ષ માટે તળાવોને વેળુટેશન મુક્ત રાખી જાળવણી કરવા અંગેનું માહીતી પત્રક વર્ષ: ૨૦૧૪-૨૦૧૫				
અ.નં	તળાવનું નામ	કોન્ટ્રાક્ટરનું નામ / સંપર્ક નંબર	એક વર્ષ સુધી જાળવણી કરવાનો કુલમાં (રૂ.)	વર્ક ઓર્ડર આપ્યા તારીખ રીન્યુ પિરિયદ
૧	રામવાડી તળાવ, ઈસનપુર.	કુમાર એજ્યુકેશન સોસાયટી (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૧,૦૫,૦૦૦/-	૦૩.૦૯.૧૪ (૨૬.૦૭.૧૪ થી ૨૫.૦૭.૧૫)
૨	વટવા મસ્ટર પાછળનું તળાવ.	માનવ સેવા સેવા સાર્વજનિક ટ્રસ્ટ (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૧,૮૦,૦૦૦/-	રીન્યુ કરેલ નથી. (રીનોવેશન ચાલતું હોઈ ખાલી છે)
૩	વાંદરવટ તળાવ, વટવા.	માનવ સેવા સેવા સાર્વજનિક ટ્રસ્ટ (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૧,૦૦,૦૦૦/-	૨૬.૦૧.૨૦૧૫ (૧૮.૦૬.૧૪ થી ૧૮.૦૬.૧૫)
૪	હાથીજાળ તળાવ, વટવા.	કુમાર એજ્યુકેશન સોસાયટી (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૬૦,૦૦૦/-	૧૭.૦૪.૨૦૧૪ (૨૦.૦૪.૧૪ થી ૧૮.૦૪.૧૫)
૫	માટીખાળ તળાવ, વટવા.	માનવ સેવા સેવા સાર્વજનિક ટ્રસ્ટ (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૮૫,૦૦૦/-	૧૧.૦૮.૨૦૧૪ (૦૧.૦૭.૧૪ થી ૩૦.૦૬.૧૫)
૬	ચંડોળા તળાવ, દાણીલીમડા.	માનવ સેવા સેવા સાર્વજનિક ટ્રસ્ટ (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૩,૭૦,૦૦૦/-	૦૩.૦૯.૧૪ (૩૧.૦૭.૧૪ થી ૩૦.૦૭.૧૫)
૭	નિકોલ ગામ તળાવ, નવા નરોડા.	મીનાકી દલિત સભી મંડળ (ફોન નં.-૦૭૯૮-૨૫૩૨૧૨૫૩)	૨,૬૦,૦૦૦/-	૦૩.૦૯.૧૪ (૨૬.૦૭.૧૪ થી ૨૫.૦૭.૧૫)
૮	મલાવ તળાવ, આંબાવાડી.	મીનાકી દલિત સભી મંડળ (ફોન નં.-૦૭૯૮-૨૫૩૨૧૨૫૩)	૧,૩૦,૦૦૦/-	૦૩.૦૯.૧૪ (૦૧.૦૭.૧૪ થી ૩૦.૦૬.૧૫)
૯	મલાય તળાવ, થલતેજ.	કુમાર એજ્યુકેશન સોસાયટી (મો.-૮૪૨૬૪૬૩૦૪૬)	૧,૭૦,૦૦૦/-	૦૩.૦૯.૧૪ (૩૧.૦૪.૧૪ થી ૩૦.૦૪.૧૫)
૧૦	સરખેજ મસ્ટર પાછળનું તળાવ.	મીનાકી દલિત સભી મંડળ (ફોન નં.-૦૭૯૮-૨૫૩૨૧૨૫૩)	૧,૦૫,૦૦૦/-	૧૧.૦૮.૧૪ (૦૧.૦૭.૧૪ થી ૩૦.૦૬.૧૫)
૧૧	રામોલ તળાવ, વસ્ત્રાલ.	જયનાગાટેવતા સેવા ટ્રસ્ટ (મો.-૮૪૨૬૩૪૨૮૫૧)		નવી મંજુરી મળેલ નથી

ઉક્ત વિગતે જે તે તળાવ માટેનાં એક વર્ષની મુદ્દત પૂરી થવા અગાઉ સક્ષમ સત્તાની મંજુરીથી વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માટે વધુ એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રિન્યુઅલ કરવામાં આવશે.

### —: લોજીસ્ટિક્સ :—

મેલેરીયા વિરોધી દવાઓ અને ઈન્સેક્ટિસાઇડસની ખરીદી, રાજ્ય સરકારશી અને સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ(અ.મ્યુ.કો.) મારફતે કરવામાં આવે છે. સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ દ્વારા ઈન્સેક્ટિસાઇડસ સપ્લાયર પાસેથી ર વર્ષ માટેનો રેઈટ કોન્ટ્રાક્ટ કરેલ છે. જે મુજબ જરૂરી ઈન્સેક્ટિસાઇડસની ખરીદી કરી આગામી ચોમાસાની સીજાન પહેલા તમામ પ્રકારની ઈન્સેક્ટિસાઇડસનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહેશે.

### -: આરોગ્ય વિષયક લોક જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ :-

- ડિસ્પ્લે પેનલ્સ - એ.એમ.ટી.એસ. બસો દ્વારા જાહેરાત, લાઉડ સ્પીકર સહિતની ઓટો રિક્ષાની બેક પેનલ્સ દ્વારા, જાહેર સ્થળોએ હોડીંગ્સ અને પેઈન્ટીંગ્સ, રેલ્વે સ્ટેશન ઉપર જાહેરાત, આઉટડોર લેડ ડિસ્પ્લે, ટીવી ચેનલ, જાહેર વિજ્ઞાપ્તિ, વિગેરે માધ્યમો દ્વારા. - અંદાજીત ખર્ચ રૂ. ૧૦ લાખ.
- રેઝિયો એફ.એમ., કેબલ ઓપરેટર્સ, સ્કોલ મેસેજીંગ્સ, ઓડીયો વીજ્યુઅલ કલીપીંગ્સ, જાહેર વિજ્ઞાપ્તિ વિગેરે માધ્યમો દ્વારા. - અંદાજીત ખર્ચ રૂ. ૫ લાખ.
- જાહેર ખબર, સ્કુલ વિદ્યાર્થીઓને બુકલેટ વિતરણ, આરોગ્ય શૈક્ષણિક પત્રિકા વિતરણ, પ્રદર્શન, શુપ મીટીંગ્સ, પ્રેસ નોટ્સ વિગેરે માધ્યમો દ્વારા. અંદાજીત ખર્ચ રૂ. ૫ લાખ.
- કંડપુતળી, ભવાઈ, ડાયરો વિગેરે માધ્યમો દ્વારા. અંદાજીત ખર્ચ રૂ. ૨ લાખ.

### -: વર્ક બેક દ્વારા સહાય :-

વર્ક બેક દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યનાં કુલ ૧૨ રાજ્યો પૈકી સુરત ભૂનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ વર્ષ ૨૦૧૨થી કરેલ છે. આ અંતર્ગત ઈન્ડિયન રેડકોસ સોસાયટી(ગુ.રા.) મારફતે નીચે જણાવેલ હોકા વાઈજ નિમણૂક કરવામાં આવેલ છે. આ માટે પુરતા નાણાંની જોગવાય ઉપલબ્ધ રાખવામાં આવેલ છે.

	Activity	Unit	Unit Cost / INR	No. of units	Posted	Total cost (INR) (2014-15)
<b>1</b>	<b>Salaries for Contractual Staff</b>					
i	District VBD Consultant	person	31,500	1	1	3,78,000
ii.	Financial & Logistic Assistant	person	10,000	1	1	1,20,000
iii.	Malaria Technical Supervisor	persons	10,500	6	5	7,56,000
iv.	Data Entry Operator	person	8,000	1	0	96,000
v.	Lab. Technicians ( 3 for AMC)	persons	10,000	3	0	3,60,000
<b>Sub Total</b>			-			<b>17,10,000</b>
<b>2</b>	<b>Mobility Cost</b>	<b>AMC</b>	<b>15,000</b>	<b>1</b>	<b>1</b>	<b>1,80,000</b>
<b>3</b>	<b>Training Cost</b>	<b>AMC</b>	<b>12,60,000</b>			<b>12,60,000</b>
<b>TOTAL</b>						<b>29,78,700</b>

## મધ્યર નિયંત્રણ - માસ વાઈજ ઈન્ટર સેક્ટરલ એક્શન પ્લાન

શહેરમાં મધ્યરજન્યરોગચાળો જેવાકે મેલેરીયા, તેન્યુ, ચિકુનગુનીયા વિગેરે અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા એક્શન પ્લાન તૈયાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અનુસંધાને નીચે જાણાવ્યા પ્રમાણેની સંબંધિત વિભાગ દ્વારા વખતોવખત કામગીરી કરવાની થાય છે.

અ.નં.	માસ	કામગીરીનો પ્રકાર	અમલ કરનાર અધિકારી
૧	જાન્યુઆરી	અગાઉના વર્ષોના કેસોની સંખ્યાના આધારે હાઈ રીઝ એરીયા નક્કી કરવા, મેપિંગ કરવા તથા બીટ પત્રક તૈયાર કરવાની કામગીરી.	મેલેરીયા સુપરવાઈજર / જુની.આસી.એન્ટોમોલોજસ્ટ (જોન)
		દરેક વોર્ડમાં આવેલ સરકારી મકાનો, થીયેટર કોમ્પ્લેક્સ, સ્કૂલ, કોલેજ, તથા અન્ય મધ્યર જન્ય ઉત્પત્તિના સ્થાનોની યાદી તૈયાર કરવી.	મેલેરીયા ઈન્સ્પેક્ટર (જોન)
૨	ફેબ્રુઆરી	મેલેરીયા વિભાગને લગતા તમામ ઈન્સેક્ટીસાઇડ મશીનરી, દવાઓ, પત્રિકાઓ વિગેરે અંગેની ડીમાંડ તૈયાર કરી એપ્રિલ માસના અંત સુધીમાં સ્ટોક ઉપલબ્ધ થાય તેવું આયોજન કરવું.	આસી.એન્ટોમોલોજસ્ટ(મેલે.)
		શહેરમાં આવેલ અલગ અલગ તળાવોમાં વેળુટેશન સાફ કરાવવા કોન્ટ્રાક્ટ નક્કી કરાવવા તથા તે અંગેના જરૂરી ટેન્ડર બહાર પાડવા, કોન્ટ્રાક્ટના ધોરણે કાયમી સફાઈ માટેની વ્યવસ્થા ગોઠવવી.	આસી.એન્ટોમોલોજસ્ટ(મેલે.)
		દરેક વોર્ડમાં કન્સ્ટ્રક્શન સાઈડની યાદી તૈયાર કરી આ યાદી દર માસે અપેટ કરવા અને બાંધકામ પૂર્ણ થયેલ હોય તેના નામ કરી નવા શરૂ થયેલ બાંધકામની યાદી સામેલ કરી દરેક કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર નોટિસો આપવી તે અંગે દર ૧૫ દિવસે તે જગ્યાનું મોનીટરીંગ કરી રજીસ્ટ્રેશન કાર્ડ નિભાવવું.	એમ.આઈ./એમ.એસ.આઈ. (વોડી) / જુની.આસી.એન્ટોમોલોજસ્ટ (જોન)
		મશીનરીના સ્પેરપાર્ટેની જરૂરી ખરીદી કરી સ્ટોકમાં રાખવા, રીપેરીંગની કામગીરીની વ્યવસ્થા કરવા .	જે.ડી.એમ. (સેન્ટ્રલ વર્કશૉપ)
		વી.એસ.હોસ્પિટ., એલ.જી., શા.ચી.લા., નગરી હોસ્પિટલ, તેન્ટલ કોલેજ, ચેપીરોગ હોસ્પિટ., માં દર ૫૦૦ પંદર દિવસે એન્ટોમોલોજિકલ સર્વેલન્સ તથા આઈ.ડી. કામગીરી કરાવવી.	એ.એમ., આર.એમ.ઓ. (હોસ્પિટલ) / આસી.એન્ટોમોલોજસ્ટ (મેલે.) દ્વારા મોનીટરીંગ કરવું
૨	ફેબ્રુઆરી	ખુનિ.સંચાલિત તમામ હોસ્પિટલમાં કોઈપણ જગ્યાએ પાણી એકનિત ન થાય, પાણીના લીકેજુસ, ડ્રેનેજ ઓવર ફ્લો ન થાય અને ટાંકીઓ ઉપર હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરવામાં આવે તેની વ્યવસ્થા કરવી.	મેરીકલ સુપ્રિન્ટેન્ડન્ટ/આસી.મેનેજર/આર.એમ.ઓ. (હોસ્પિટલ)
		આઈ.આર.એસ. કામગીરી માટે સ્પ્રેયર પંપ, અન્ય જરૂરી સાધનોની ચકાસણી તથા જરૂરીયાત	આસી.એન્ટોમોલોજસ્ટ (મેલે.)

		મુજબ ખરીદી કરવા અંગેની દરખાસ્ત રજુ કરવી.	
		આઈ.આર.એસ. કામગીરી માટે સ્ટાફને તાલીમનું આયોજન કરવું.	આસી.એન્ટોમોલોજસ્ટ (મેલે.)/ડ.હેલ્થ ઓફિસર(ઝોન)
૩	માર્ચ/એપ્રિલ	સ્કુલ કોલેજ તથા સ્લભ, ચાલીમાં ચુપ મીટિંગ કરી મય્યરજન્ય રોગચાળો અટકાવવા અંગેના પગલાં અંગે નાગરીકોને માહિતગાર કરવા.	આસી.હેલ્થ ઓફિસર (ઝોન)/જુની.આસી.એન્ટોમોલોજસ્ટ (ઝોન) / એમ.ઓ.(અ.હે.સે.)
		ટી.વી.ચેનલ તથા પ્રેસ દ્વારા આઈઈસી માટેની વ્યવસ્થા અને એન.જી.ઓ. સાથે સંકલન.	ડ.હેલ્થ ઓફિસર (એપી.) / આસી.એન્ટોમોલોજસ્ટ(મેલે.)
		હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા દરેક વોર્ડમાં આવેલ ટાયરની હુકાનો, સર્વિસ સ્ટેશન, ભંગારની હુકાનો તથા અન્ય જગ્યાએ પેલ સ્કેપ ઉપાડવવા ની વ્યવસ્થા કરાવવી, અને આ કામગીરી દર ૧૫ દિવસે થાય તે માટે આયોજન કરવું.	ડ.હેલ્થ ઓફિસર(ઝોન)/ મેલે.સુપરવાઈઝર(ઝોન)
		સ્કેપ ઉપાડવા માટે સંબંધિત ઝોનના ડ.હેલ્થ ઓફિસરશી દ્વારા મેલેરીયા વિભાગ માટે વાહનની વ્યવસ્થા કરવાની રહેશે.	સેની.સુપ્રી.
		શહેરમાં આવેલ તમામ હુવારા ચેક કરી હુવારામાંથી પાણી કાઢી શકાય તે રીતે ડ્રેનેજની વ્યવસ્થા થાય, અથવા પમ્પ દ્વારા વ્યવસ્થા કરવા અને હુવારાની સફાઈ નિયમીત રીતે કરાવવા.	એ.સી.ઈ.(વોડી)
		રાજ્ય સરકારશી દ્વારા આપવામાં આવી અન્ટી મલેરીયલ દવાઓ તથા એ.સી.ટી. વિગરેનો જથ્થો મેળવવો.	એ.ઈ.(મેલેરીયા)
		આઈ.આર.એસ. કામગીરી માટે વર્કરોને તાલીમ આપવાનું આયોજન કરવું.	જુની.આસી.એન્ટોમોલોજસ્ટ / મેલે.સુપરવાઈઝર(ઝોન)
૪	મે	મેલેરીયા મન્યના અનુસંધાનમાં ઘનિષ્ઠ આઈઈસી કામગીરી, હાઇરીસ્ક એરીયામાં આઈ.ડી. કામગીરી કરાવવી.	એ.ઈ.(મેલેરીયા)
		સ્કુલ તથા તમામ ચુનિ.બીલીંગની તમામ પાણીની ટાંકીઓ હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરાવવી, ટાંકીના વાલ્વ, કુંડી રીપેરીંગ કરાવવા,	એ.ઓ.સ્કુલબોર્ડ / એ.સી.ઈ.(વોડી) / પી.એચ.એસ.
		સેન્ટ્રલ વર્કશોપ દ્વારા તમામ ફોર્માં મશીન, લીકો મશીન, સર્વિસ/રીપેર કરાવી ચાલુ હાલતમાં રાખવા અંગે ચેક કરાવી લઈ તેની ખાત્રી કરાવવી.	જ.ડિ.એમ.(વર્કશોપ)
		ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, ટ્યુબવેલ સ્ટશેન, ગાર્ડનની અંદર આવેલ વાલ્વ, કુંડીઓ સાફ કરાવીને લીકેજ બંધ કરાવવા.	એડી.સી.ઈ.(ડ્રેનેજ/વોડર) / એ.સી.ઈ.(વોડી)
		લેબોરેટરીમાં તમામ માઈકો સ્કોપ સર્વિસ કરાવવા, રીપેરીંગની જરૂરીયાત હોય તો તે સમયસર રીપેરીંગ કરાવવા વ્યવસ્થા કરવી અને મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટર નક્કી કરાવવા.	એ.ઈ.મેલેરીયા / ઓ.એમ.એસ.- સી.એમ.એસ.
		મેલેરીયા વિભાગ દ્વારા દરેક અર્બન હેલ્થ	મેડિકલ ઓફિસર

		<p>સેન્ટરમાંથી કોસ ચેક્ઝિંગ માટેની સ્લાઇડો અંગે તપાસની વ્યવસ્થા કરાવવા અને દરેક કેન્દ્રો ઉપર એક માસ સુધી સ્લાઇડો સાચવી રાખવી.</p> <p>મેલેરીયા વિભાગ દ્વારા શહેરમાં આવેલ હુવારા, તળાવ, છવાડા, તથા અન્ય જગ્યાએ ગાપ્પી માછલીઓ ઉછેરવા માટેની વ્યવસ્થા અને દર પંદર દિવસે આ જગ્યાની ચકાસકી કરી જરૂરીયાત પ્રમાણે વધુને વધુ માછલી નાંખવા માટેની વ્યવસ્થા .</p> <p>અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા તમામ તાવના કેસો તથા ફીલ્ડસ્ટાફ દ્વારા તેમને સોંપવામાં આવેલ વિસ્તારમાં તાવના કેસોનું બ્લડ સ્મીયર કલેક્શન વધુ ઘનિષ્ઠ બનાવવા.</p> <p>મેલેરીયા લેબોરેટરીમાં લેબ .ટેકનીશીયનની જરૂરીયાત પ્રમાણે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વ્યવસ્થા કરવા તથા બ્લડ સ્મીયરની તપાસ નિયમીત થાય અને બેક લોગ ન થાય તે અંગેની વ્યવસ્થા કરવા.</p> <p>તમામ મેલેરીયાની દવાઓ નેશનલ ડ્રગ પોલીસી મુજબ દરેક અર્બન હેલ્થ સેન્ટર તથા મ્યુનિ. હોસ્પિટલમાં જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ કરવા અને તેનું મોનીટરીંગ કરાવવા.</p>	એમ.એસ. / એમ.આઈ. (ઝોન)
		<p>તમામ મેલેરીયાની દવાઓ નેશનલ ડ્રગ પોલીસી મુજબ દરેક અર્બન હેલ્થ સેન્ટર તથા મ્યુનિ. હોસ્પિટલમાં જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ કરવા.</p>	આસી.હેલ્થ ઓફિસર / જુની.આસી.એન્ટોમોલોજિસ્ટ (ઝોન)
		<p>તમામ મેલેરીયાની દવાઓ નેશનલ ડ્રગ પોલીસી મુજબ દરેક અર્બન હેલ્થ સેન્ટર તથા મ્યુનિ. હોસ્પિટલમાં જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ કરવા.</p>	એમ.ઓ.- યુ.એચ.સી. / સુમી.હોસ્પિટલ
૪	મે	<p>લેબોરેટરી માટેના કેમીકલ્સ તથા અન્ય જરૂરી સાધનો પૂરતા સ્ટોકમાં રાખવા.</p> <p>ઈજનેર ખાતા હસ્તક આવેલ રોડ ખાતાના સ્ટોર તથા અન્ય સ્ટોરમાં સકેપ, ડામરના ખાતી પીપડા હોય તેને દૂર કરાવવા અને ચોમાસામાં પાણી ભરાઈ ન રહે તેવી વ્યવસ્થા કરવા.</p> <p>મ્યુનિ.સંચાલિત વી.એસ., શા.ચી.લા., તથા એલ.જી. હોસ્પિટલમાં અલગ ફીવર કલીનીક શરૂ કરવા તથા તમામ તાવના દર્દીઓનું બ્લડ સ્મીયર લઈ તાત્કાલીક તપાસ કરી નેશનલ પ્રોગ્રામ મુજબ દવાઓ આપવાની વ્યવસ્થા કરવા.</p> <p>તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર તેનું તથા ચિકિત્સા ગુનીયાના નિદાન માટે સીરમ સેમ્પલ લેવા માટેના ટેસ્ટીંગ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવા અને રિપોર્ટ મેળવીને સંબંધિત વિભાગમાં જરૂરી પ્રીવેન્ટીવ મેઝર્સ લેવા તથા સારવાર અંગેની વ્યવસ્થા કરવા.</p> <p>તમામ સ્ટાફ માટે ટ્રેનિંગ, મેડિકલ ઓફિસર, લેબ. ટેકનીશીયન, મલ્ટી પરપાં હેલ્થ વર્કર, લીક વર્કર.</p> <p>રેલ્વે, આર્મ્સ, આર.એ.એફ., સીવીલ હો,</p>	એમ.ઓ. (યુ.એચ.સી.)
		<p>એડી.સી.ઈ. (ઝોન) એન્ડ રોડ પ્રોજેક્ટ / એ.સી.ઈ. (વોર્ડ)</p>	
		<p>આરી.હે.ઓ. / જુની.આરી. એન્ટોમોલોજિસ્ટ (ઝોન) / એમ. એસ. (તમામ ઝોન)</p>	
		<p>એ.ઈ.મેલેરીયા / એમ.એસ. (ઝોન)</p>	
		<p>ટે.હે.ઓ. (તમામઝોન) / એ.ઈ.મેલેરીયા</p>	
		<p>એ.ઈ.હે.ઓ. (તમામઝોન) / એ.ઈ.મેલેરીયા</p>	

		પોલીસ વિભાગ, યુનિવર્સિટી, આઈ.આઈ.એમ., એન.આઈ.ડી વિગેરે તથા કોપોરિશનના અન્ય વિભાગો સાથે સંકલન મીટિંગનું આયોજન.	
૫	જુન થી નવેમ્બર	ચોમાસા દરમ્યાન દરેક વોર્ડમાં તથા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલ હોય તેનો નિકાલ માટેની વ્યવસ્થા કરાવવી.	ડ.સી.ઈ.ઝોન
		મોટા ખોટો અને નીચાણવાળા ભાગમાં પાણી ભરાયેલ હોય તો તે તાત્કાલીક ડી વોટરીંગ કરવા છીજનેર અને હેલ્થ વિભાગની સંકલનથી કામગીરી કરવા અને ખાનગી ખોટો હોય તો તેઓની પાસેથી જરૂરી ચાર્જ વસુલ કરવા એસ્ટેટ ખાતાના સંકલનમાં રહી કાર્યવાહી કરવી.	એ.મ.એસ.ઝોન/ એ.સી.ઈ. વોડે/ એસ્ટેટ ઇન્સ્પેક્ટર
૫	જુન થી નવેમ્બર	સેન્ટ્રલ મેલેરીયા લેબોરેટરીમાં બેકલોગની બ્લડ સ્મીયર તપાસની અને લેબ ટેકનીશીયનોની જરૂરી વ્યવસ્થા કરવી.	એ.ઈ.મેલેરીયા
		દેથ કેસના ઓડીટ એન.એચ.એલ. મેડીકલ કોલેજ (પીએસએમ ડીપા.) દ્વારા વી.એસ. હોસ્પિચા.ચી.લા. હોસ્પિચા.માં થતા તમામ મરણાના કેસોનું દેથ ઓડીટ કરી તેનું સમયસર રિપોર્ટિંગ કરવા. સીવીલ હોસ્પિચા.એલ.જી.હોસ્પિચા.માં થતા તમામ મરણાના કેસોનું દેથ ઓડીટ કરી તેનું સમયસર રિપોર્ટિંગ કરવાની કામગીરી એ.એમ.સી.મેટ મેડીકલ કોલેજ દ્વારા કરવાની રહેશે.	પી.એસ.એમ.ડીપા., એન.એચ.એલ. અને એલ.જી.મેડીકલ કોલેજ / ડે.હેલ્થ ઓફિસર (એપી.)
૬	ડિસેમ્બર	વર્ષ દરમ્યાન કરેલ કામગીરીનો સંકલિત અને વિગતવાર વાર્ષિક અહેવાલ તૈયાર કરવું.	એ.ઈ.(મેલેરીયા)

ઇન્દ્રા ડેમેસ્ટ્રીક પોરાનાશક કામગીરી દર માસે કરવાની રહેશે. રાઉન્ડની સંઘય આરોગ્ય અધિકારીશ્રી નક્કી કરશે. મન્દુરના પોરા અને એડલટ ડેન્સીટી દર અદવાડીયે મોનીટરીંગ કરવાની રહેશે. કન્સ્ટ્રક્શન સાઈટનું ચેકીંગ રૂટીનમાં કરવાનું રહેશે. તમામ ઝોન/વોર્ડ ખાતેની કામગીરીની જરૂરીયાત મુજબ રોજંદા વર્કરો, આઈ.આર.એસ. એક્ટીવીટી માટે તથા આઈ.ઈ.સી. એક્ટીવીટી માટે લાઉડ સ્પીકર સહિતની ઓટો રિશ્કા અને સુપર ડિલ્ક્ષન ફોર્મીંગ મશીનો માટે લોડીંગ રિશ્કાઓની સમયસર વ્યવસ્થા કરાવવાની રહેશે. માટે જુન થી નવેમ્બર માસ દરમ્યાન મ્યુ. સંચાલિત શેઠ લ.ગો., શ્રીમતી એન.એચ.એલ.મેડીકલ કોલેજ ખાતેની પ્રિવેન્સન એન્ડ સોશીયલ મેડીસીન વિભાગ દ્વારા પ્રતિ કોલેજની રૂધી કુલ ૪ ટીમ દ્વારા ફૈનિક ધોરણે ૨ વોર્ડ ખાતેની ફિલ્ડ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે ( ટીમ માટે જરૂરી વાહનની વ્યવસ્થા કે.ડી.એમ.શ્રી-વર્કશોપ દ્વારા કરાવવાની રહેશે).

-:: મન્દુર ઉપદ્રવ / મન્દુરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે  
આરોગ્ય-મેલેરીયા વિભાગની કામગીરી ::-

વિભાગ	કામગીરી
-------	---------

<p><b>ઝોનલ આરોગ્ય મધ્યસ્થ કચેરી</b></p>	<p><b>૩.હેલ્થ ઓફિસર :-</b>  <b>વોર્ડ અર્બન હેલ્થ સેન્ટર અને મેલેરીયા વિભાગ દ્વારા કરવામાં આવતી દૈનિક કામગીરીનું મોનીટરીગ રાખવું. ચાલુ બાંધકામ સાઈટો / અન્ય એકમો દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો નામુદ કરવા માટે મેલેરીયા વિભાગ દ્વારા આપેલ નોટીસનો અનાદર કે સુચવેલ પગલાં ન લેવામાં આવે તેવા ડિસ્સામાં એસેટ વિભાગ(જોન) સાથે સંકલન સાધી બાંધકામની પરવાનગી રદ કરવા કે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવી વિગેરે.</b></p> <p><b>આસી.હેલ્થ ઓફિસર :-</b>  <b>૩.હેલ્થ ઓફિસર(જોન) દ્વારા વખતો વખતો આપેલ સુચના મુજબ તેનો અમલ કરાવવો. મેલેરીયા વિભાગની દૈનિક કામગીરી અસરકારક રીતે થાય તેનું મોનીટરીગ રાખવું. અર્બન હેલ્થ સેન્ટર કક્ષાએ એન્ટી મેલેરીયલ ડ્રગ્સ ભારત સરકારશ્રીની નેશનલ ડ્રગ પોલીસી મુજબ પુરે પુરી આપવામાં આવે તેનું મોનીટરીગ રાખવું. તમામ વોર્ડ ખાતેની દૈનિક કામગીરીનું કંપાઈલેશન કરાવવું વિગેરે.</b></p> <p><b>સેનીટરી સુપ્રાન્ટેન્નાન્ટ(ઝોન) :-</b>  <b>બીન વારસી લાવારીશ સ્કેપ/બંગાર/ટાયરો ઉપાડવા માટે ૩.હેલ્થ ઓફિસર મારફત મેલેરીયા વિભાગ માટે વાહનની વ્યવસ્થા કરવી.</b></p>
<p><b>વોર્ડ અર્બન હેલ્થ સેન્ટર</b></p>	<p><b>મેડિકલ ઓફિસર :-</b>  <b>મચ્છરનાં પોરાનાશક કામગીરી અંતર્ગત લીક વર્કરો મારફતે પ્રોપર ઈન્ટ્રાડોમેસ્ટીક એક્ટીવીટી થાય અને તાવનાં દરેક દર્દીનો લોહીનો નમુનો મેળવવામાં આવે અને તેનું સમયસર મેલેરીયા પરિક્ષણનાં આધારે મલ્ટી પર્ફલ હેલ્થ વર્કરો મારફતે જરૂરી ફોલોઅપ થાય તે સુનિશ્ચિત કરવું.</b></p>
<p><b>વોર્ડ અર્બન હેલ્થ સેન્ટર</b></p>	<p><b>લેબોરેટરી ટેકનીશીયન :-</b>  <b>લીક વર્કરોએ મેળવેલ લોહીના નમુનાનું ચોક્કસ નિદાન કરવું. આ ઉપરાંત ઓ.પી.ડી.માં આવતાં દર્દીઓ પૈકી જાહેર થયેલ મેલેરીયાનાં કેસોમાં ભારત સરકારશ્રીની નેશનલ ડ્રગ પોલીસી મુજબ પુરે પુરી એન્ટી મેલેરીયલ ડ્રગ્સ આપી તેનું જરૂરી ફોલોઅપ કરવું.</b></p> <p><b>મલ્ટી પર્ફલ હેલ્થ વર્કર :-</b>  <b>લીક વર્કરોની કામગીરીનું અસરકારક સુપરવિઝન કરવું અને જાહેર થયેલ મેલેરીયાનાં દર્દી દ્વારા આપવામાં આવેલ એન્ટી મેલેરીયલ ડ્રગ્સ નિયમ અનુસાર પુરે પુરી લિધેલ છે કે કેમ આ અંગેનું જરૂરી ફોલોઅપ કરવું.</b></p> <p><b>લીક વર્કર :-</b>  <b>નિયમીત ધોરણે પ્રોપર આઈ.ડી.એક્ટીવીટી અંતર્ગત સોપેલ વિસ્તારમાં એક પણ પોકેટ છુટી ના જાય તે ધ્યાન રાખવું. તાવનાં દરેક દર્દીનો લોહીનો નમુનો પ્રોપર રીતે મેળવવામાં આવે વિગેરે.</b></p>
<p><b>મેલેરીયા મધ્યસ્થ કચેરી</b></p>	<p><b>આસી.એન્ટોમોલોજિસ્ટ :-</b>  <b>મેલેરીયા વિભાગ-તમામ ઝોન કક્ષાએ થતી દૈનિક કામગીરીનું અસરકારક સુપરવિઝન અને મોનીટરીગ રાખવું. તમામ ચ્ય.છોસ્પીટલો/રેફરલ છોસ્પીટલો/જનરલ છોસ્પીટલો/અર્બન હેલ્થ સેન્ટરો ખાતે એન્ટી મેલેરીયલ ડ્રગ્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ રખાવવા માટેની આનુસારિંગ કાર્યવાહી સમયસર હાથ ધરવી. આઈ.દી.સી. એક્ટીવીટી ઘનિષ્ઠ બનાવવી, જરૂરીયાત અનુસાર રોજાંદા મજૂરો રખાવવા, વિવિધ પ્રકારની ઈન્સેક્ટીસાઇડિઝ ઉપલબ્ધ રખાવવી, કોન્ટ્રાક્ટથી તળાવોને વેજાટેશનમુક્ત રખાવવા, દૈનિક / અઠવાડીક રિપોર્સનાં આધારે જરૂરી વિશ્લેષણ અને તે મુજબ તમામ ઝોન/વોર્ડ વિસ્તારમાં ચુસ્ત અમલીકરણ કરાવવું વિગેરે.</b></p>
<p><b>મેલેરીયા વિભાગ(ઝોન)</b></p>	<p><b>મેલેરીયા સુપરવાઇઝર :-</b>  <b>તમામ વોર્ડ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવાની દૈનિક ધોરણની કામગીરીનું અસરકારક સુપરવિઝન કરવું. અર્બન હેલ્થ સેન્ટર ખાતે જરૂરી આઈ.ડી.ફોર્મ્સ, માર્કિંગ કલર ચોક, પ્રોપર એબેટ સોલ્યુશનની પુરતી કરાવવી. સેન્ટ્રલ વર્કશોપ ખાતે જરૂરી સંકલન સાધી વિવિધ પ્રકારનાં ફોગીંગ મશીનો / સ્પ્રેયર પંપો સમયસર રિપેરીંગ / સર્વિસ થાય તે જોવું. ચાલુ બાંધકામ સાઈટો / અન્ય એકમો દ્વારા</b></p>

	<p>મધ્યર ઉત્પત્તિસ્થાનો નામું કરવા માટે મેલેરીયા વિભાગ દ્વારા આપેલ નોટીસનો અનાદર કે સુચવેલ પગલાં ન લેવામાં આવે તેવા કિસ્સામાં તે.હેલ્થ ઓફિસર(ઝોન)ને જાણમાં લાવી ફોલોઅપ કરવું. બીજી વારસી ટાયરો/બંગાર ઉપાડવાની ગુંબેશ જરૂરીયાત અનુસાર નિયમીત ધોરણે થાય તે માટે ઝોન/એસ્ટેટ વિભાગનાં સંકલનમાં રહી ફોલોઅપ કરવું, કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવતી તળાવોની સફાઈ કામગીરીનું મોનીટરીંગ રાખવું, દૈનિક રિપોર્ટિંગ વિગેરે.</p> <p><u>મેલેરીયા ઈન્સ્પેક્ટર :-</u></p> <p>મેલેરીયા સુપરવાઈઝરનાં સંકલનમાં રહી તમામ વૉર્ડ વિસ્તારમાં મધ્યરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે મેલેરીયા વિભાગ દ્વારા આપેલ નોટીસનો અનાદર કે સુચવેલ પગલાં ન લેવામાં આવે તેવા કિસ્સામાં વહીવટી દંડ પેટે નાણાંની વસુલાત કરવી, બી.પી.એમ.સી.એક્સ્ટ હેઠળ કોટમાં ફરિયાદ દાખલ કરવી. બીજી વારસી ટાયરો/બંગાર ઉપાડવાની ગુંબેશ જરૂરીયાત અનુસાર નિયમીત ધોરણે થાય તે માટે ઝોન/એસ્ટેટ વિભાગનાં સંકલનમાં રહી ફોલોઅપ કરવું વિગેરે.</p> <p><u>મેલેરીયા સબ ઈન્સ્પેક્ટર :-</u></p> <p>મેલેરીયાનાં કેસો / જાહેર ફરિયાદ વિસ્તારમાં મેલેરીયા વર્કરો મારફતે ઘનિષ્ઠ મધ્યરનાશક / પોરાનાશક કામગીરી કરાવવી. આરોગ્ય વિષયક પત્રિકા વિતરણ, ગૃહ મીટિંગ, શાળા / કોલેજોમાં આરોગ્ય પ્રદર્શન દ્વારા લોક જગ્યાતિ કેળવવી. અર્બન હેલ્થ સેન્ટર ખાતે જરૂરી આઈ.ડી.ફોર્મ્સ, માર્કિંગ કલર ચોક, પ્રોપર એબેટ સોલ્યુસનની પુર્તતા કરવી. ચાલુ બાંધકામ સાઈટો ખાતે નિયમીત ધોરણે સર્વે હાથ ધરી મધ્યર ઉપદ્રવ નિયંત્રણ વિષયક વિનંતીપત્ર પાઠવવા તેમજ મજૂર વર્ગમાં ફિવર સ્ક્રિનિંગ કરવું. વૉર્ડ પ્રોફાઇલ અપગ્રેડ રાખવી. મધ્યરજન્ય રોગો વાઈઝ મેપીંગ અપગ્રેડ રાખવું. મધ્યરજન્ય રોગો માટેનાં હાઈરિસ્ક વિસ્તારોમાં નિયમીત ધોરણે મોનીટરીંગ રાખવી. તળાવો, કુવાર, મોટા હોજ, હવાડા જેવી જગ્યાઓએ પોરાભક્ષક માછલીઓ મુકવી.</p>
--	---

#### અન્ય વિભાગ / મધ્યરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે અન્ય વિભાગોની કામગીરી

વિભાગ	કામગીરી
સેન્ટ્રલ વર્કશોપ	<p><b>જોઈન્ટ ડાયરેક્ટર :-</b></p> <p>વિવિધ પ્રકારનાં ફોગીંગ મશીનોનાં સ્પેર પાર્ટ્સની જરૂરી ખરીદી કરી સ્ટોકમાં રાખવા, રિપેરીંગ કામગીરીની યોગ્ય વ્યવસ્થા કરવી.</p> <p>મ્યુ. સંચાલિત શેઠ લ.ગો., શ્રીમતી એન.એચ.એલ.મેરીકલ કોલેજ ખાતેની પ્રિવેન્સન એન્ડ સોશીયલ મેડીસીન વિભાગ - પ્રતિ કોલેજની ૨ દીઠ કુલ ૪ ટીમ માટે માહે જુન થી નવેમ્બર માસ સુધી વાહનની વ્યવસ્થા કરવી</p>
જનરલ હોસ્પિટલ	<p><b>આસી.મેનેજર / આર.એમ.ઓ. :-</b></p> <p>હોસ્પિટલ પ્રિમાઈસીસ / કંપાઉન્ડમાં કોઈપણ જગ્યાએ પાણી એકનિત ન થાય, પાણીનાં લીકેજ્સ, ડ્રેનેજ ઓવર ફ્લો ન થાય અને ટાંકીઓ ઉપર હવા ચુસ્ત ઢાંકણ બંધ કરવામાં આવે તેની વ્યવસ્થા કરવી. દર ૧૫ દિવસે એન્ટોમોલોજીકલ સર્વેલન્સ તથા ઇન્ટ્રો ડેમેરીક કામગીરી થાય તે માટે જે તે સેનીટરી સુપરવાઈઝરી સ્ટાફની જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે.</p> <p><b>મેડીકલ સુપ્રિન્ટેન્નાન્ટ :-</b></p> <p>જરૂરીયાત પ્રમાણે લેબોરેટરી ટેકનીશીયનો, કોન્ટ્રાક્ટ પણ્ણતિથી વ્યવસ્થા કરવા તથા બ્લડ સ્મીઅરની તપાસ નિયમીત ધોરણે થાય અને બેકલોગ ન રહે તે અંગેની વ્યવસ્થા કરવી. અલગથી ફિવર કલીનિક શરૂ કરી દઈનાં બ્લડ સ્મીઅરની તાત્કાલીક તપાસ કરી નેશનલ ડ્રગ પોલાસી મુજબ એન્ટી મેલેરીયલ રૂસ આપવાની વ્યવસ્થા કરવી.</p>

સ્કુલ બોર્ડ	<p>એડમીનિસ્ટ્રેટીવ ઓફિસર :-</p> <p>સ્કુલ પ્રિમાઇસીસમાં પાણીની તમામ ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રખાવવી, ટાંકીનાં વાલ્વ, કુંડી રિપેરીંગ કરાવવા, પાણીનાં લીકેજુસ, ડ્રેનેજ ઓવર ફલો ન થાય અને ટાંકીઓ ઉપર હવા ચુસ્ત ઢાંકણ બંધ કરવામાં આવે તેની વ્યવસ્થા કરવી.</p>
ઈજનેર વિભાગ	<p>આસી.સી.ટી ઈજનેર(વોર્ડ) :-</p> <p>સ્કુલ તથા તમામ મ્યુ.બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં પાણીની તમામ ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રખાવવી, ટાંકીનાં વાલ્વ, કુંડી રિપેરીંગ કરાવવા, ઈજનેર ખાતા હસ્તક આવેલ રોડ ખાતાનાં સ્ટોર તથા અન્ય સ્ટોર ખાતે સ્કેપ, ડામરનાં ખાલી પીપ હોય તો તેને દુર કરાવવા અને ચોમાસામાં પાણી ભરાય ન રહે તેવી વ્યવસ્થા કરવી. ચોમાસા દરમ્યાન દરેક વોર્ડમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલ હોય તો તેનો યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરાવવી.</p> <p>આસી.સી.ટી ઈજનેર(ડ્રેનેજ/વોટર) :-</p> <p>તમામ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, ટ્યુબવેલ સ્ટેશન, ગાર્ડનની અંદર આવેલ વાલ્વ, કુંડીઓ સાફ કરાવી લીકેજુસ બંધ કરાવવા.</p> <p>આસી.સી.ટી ઈજનેર(લાઈટ) :-</p> <p>સમગ્ર શહેરમાં જાહેર સ્થળો / મ્યુ.પ્રિમાઇસીસમાં આવેલ કુવારા, વાલ્વનાં લીકેજુસ બંધ કરાવવાની વ્યવસ્થા અને સતત મોનીટરીંગ રાખવું.</p> <p>ડ.સી.ટી ઈજનેર(ઝોન) :-</p> <p>ચોમાસા દરમ્યાન દરેક વોર્ડમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલ હોય તો તેનો યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરાવવી.</p> <p>એડી.સી.ટી ઈજનેર (બ્રાજ પોઝેક્ટ) / ડ.સી.ટી ઈજનેર(હાઉસીંગ પ્રોજેક્ટ / રોડ પ્રોજેક્ટ)</p> <p>પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ કામગીરીની જગ્યાએ કે ઉપયોગી બેરલ અથવા અન્ય સાધનોમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય કે આસપાસમાં પાણી સ્થાંગિત ના રહે તે માટે નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી.</p>
એસ્ટેટ વિભાગ	<p>ડ.એસ્ટેટ ઓફિસર (ઝોન) :-</p> <p>દબાણ વિભાગનાં તમામ સ્ટોર્સ ખાતે જમા રાખેલ સાધનો, ચીજ, વસ્તુઓમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય તે માટે ઊંઘ કરીને રાખવું અથવા તાડપતરીથી ઢાંકીને રાખવું અથવા શેડ નીચે રાખવું.</p>
સાબરમતી રિવર્ફન્ડ ટેવલપમેન્ટ / બી.આર.ટી.એસ. પ્રોજેક્ટ	<p>જનરલ મેનેજર(વહીવટ) / એરિશનલ સી.ટી ઈજનેર :-</p> <p>પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ કામગીરીની જગ્યાએ કે ઉપયોગી બેરલ અથવા અન્ય સાધનોમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય કે આસપાસમાં પાણી સ્થાંગિત ના રહે તે માટે નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી.</p>
ગાર્ડન / પાર્કસ	<p>ડાયરેક્ટર :-</p> <p>તમામ કુવારા, વાલ્વ, કુંડીઓ સાફ કરાવી લીકેજુસ બંધ કરાવવાની વ્યવસ્થા કરવી.</p>
સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ	<p>ઓફિસર, ઈ.ચા.મેડીકલ સપ્લાય :-</p> <p>હોસ્પિટલો/અ.હે.સે./ ખાતેનાં તમામ માઈક્રોસ્કોપ સર્વિસ કરાવવા, રિપેરીંગની જરૂરીયાત હોય તો સમયસર રિપેરીંગ કરાવવા અંગેની વ્યવસ્થા કરવી અને મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ નક્કી કરવું. નેશનલ ડ્રગ પોલીસી મુજબ તમામ પ્રકારની એન્ટી મેલેરીયલ ડ્રગ્સ, હોસ્પિટલો / અ.હે.સે. ખાતે સપ્લાય કરવું અને જરૂરી મોનીટરીંગ રાખવું.</p>

<p>એન.એચ.એલ.ભ્ય.મેડીકલ કોલેજ / ન્યુ એલ.જ.મેડીકલ કોલેજ</p>	<p><b>પ્રિવેન્સન એન્ડ સોશીયલ મેડીસીન ડિપાર્ટમેન્ટ :-</b> શેઠ વા.સા. અને શ્રીમતી શા.ચી.લા.ભ્ય. હોસ્પિટલમાં નોંધાતા તમામ રોગનાં મરણ કેસોમાં દિન-૭ માં તેથ ઓડીટ કરી તેનું સમયસર રિપોર્ટિંગ કરવું.</p>
<p>ભ્ય. હોલ / સ્ટેડીયમ / પીકનીક હાઉસ / પાર્ટી પ્લોટ / સાનાગાર / કંકરીયા લેકફન્ટ ડેવપલપમેન્ટ / ઝુ / ભ્યુલિયમ / બાલભવન</p>	<p><b>મેનેજર / સાનગાર સુપ્રાન્ટેનેન્ટ / આસી.મેનેજર(ક.એલ.એફ.) / ઝુ સુપ્રાન્ટેનેન્ટ</b> અન્ડર ગ્રાઉન્ડ / ઓવરહેડ ટેક, અન્ય પાણી સંગ્રહીત પાત્રો હવાચુસ્ત ઢાંકણ થી બંધ રાખવા અને અઠવાડીયામાં એક વખત ખાલી કરી સાફ કરી ઉપયોગમાં લેવા. પાણીની પાઈપ લાઈન / ડ્રેનેજ લાઈન, ફુવારા, વાલ્વ, કુંડીઓ સાફ કરાવી લીકેજ્લ્સ બંધ કરાવવાની વ્યવસ્થા કરવી.</p>
<p>શાળા / કોલેજ / થિયેટર / કોમર્શિયલ કોમ્પ્લેક્સ / મોલ</p>	<p><b>આચાર્ય / મેનેજર :-</b> અન્ડર ગ્રાઉન્ડ / ઓવરહેડ ટેક, અન્ય પાણી સંગ્રહીત પાત્રો હવાચુસ્ત ઢાંકણ થી બંધ રાખવા અને અઠવાડીયામાં એક વખત ખાલી કરી સાફ કરી ઉપયોગમાં લેવા. પાણીની પાઈપ લાઈન / ડ્રેનેજ લાઈન, ફુવારા, વાલ્વ, કુંડીઓ સાફ કરાવી લીકેજ્લ્સ બંધ કરાવવાની વ્યવસ્થા કરવી. આરોગ્ય વિભાગનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા આપેલ સુચના મુજબ અમલ કરવુ.</p>

હેલ્થ મેલેરીયા વિભાગ.  
અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન.